

- \* જે સેક્સની વાતે કહે તેવધે સેક્સી અને જે સેક્સની વાતે ન કહે તેનથિસ □ વું મનવાની જૂથ નથી.
- \* દેખાવમં જેના હાઇટ - બેડી - ટુંઘ્સ□ તે વધે સાથ હોય તેમા જાતયિ અંગો વધે મેટા અને હુષ□ ટ પુષ□ ટ હોય □ જૂથી નથી.
- \* પોતની પત્ની સાથે સમગમ ન કથી શકે તે પુષ્પ અન□ ચ સ□ ત્ થી પ□ થત્ને આકથ□ ધાયેલો હશે □ વું ધથી લેવાની જૂથ નથી.
- \* આથી ઊલટું શક્ય છે કે અન□ ચ સ□ ત્ થીનો સંગ કથ્નાથ પુષ્પ પત્ની નીને પહેલા કથ્તં વધે ટૂમ□ તકથ્તે હોય!
  
- \* જે પત્ની સેક્સની મંગણી નથી કથ્તે તેને સેક્સની ઇચ□ છા ન હશે □ વું મ્નાવું ભૂલભેલું છે. સામે છેડે સેક્સની મંગણી કે પહેલ કથ્નાથ વધે ક્રામ્ક હોય છે, □ વું ચ નથી.
- \* અલગ અલગ આસનો ચા પોઝીશનો પ□ ય્યોજનાથ યુગલો કંઈ વધુક્રામ્ક નથી હોત. તે□ વધુફ□ થેન□ ક તથ પ□ ય્યોગશીલ જૂથ હોય છે.
- \* ક્યારેક સૌંદર્ય કથ્તં લોભમ્ણ વત્ષ□ ન, રેનચળા ઇશાય, કામ્પ□ થેચ્ક ઇંગતિ વધે આકથ□ ષણ જન□ મવે છે.
- \* લડાઇ ઝગડા બદ પત્ની પત્ની ક્યારેક સેક્સ ભેગવી પોતના ઝઘડાનુ સોલ□ યુશન લાવછે.
- \* અલ□ પવકિસતિસ□ ત્મથી જો છોકથીને આત્ મ્હત્નીયા કથ્વાના વચિથે આવત હોય તે તેણે પહેલા મ્મની સાથ્વાથ કથ્વી જોઇ□ પછી સ□ ત્મની.
- \* ક્યારેક રહથે જોઇને વ□ ચકિતિહોમેસેક્સ□ યુઅલ છે ક નહી તેમો અંદાજ નહીં અંધમો. ઘણીવાથ □ મં મેટી ગેથ્સમ્જ થઈ શકે છે.
- \* મેટી મેટી જાતયિ વક્રિત□ ધ્યવત મણસો દેખાવમં ત્દન સીધ અને સાધથ્થા હોય શકે.
- \* સેક્સ કથ્ત્ મ કથ્ત્નીયા બદ સામન□ ચત થેડા કલાકો સુધી પુષ્પ સેક્સમં ઇચ□ છા ગુમવી દે છે. આ સમ્યગાળા 'થીફ□ ટેકટથી પીથીચડ' કહેવાય છે. પણ ક્યારેક આનાથી ઊલટુ બને છે અને □ કવાથ સેક્સ મણયા બદ બીજીવાથ સેક્સ મણવાની ઇચ□ છા વધુબ્જાવત્ ત્દ બને છે.
- \* કોઈ □ ક વ□ ચકિતિ પથ્સિ□ થતિયા વાતવથ્થા મ્મમં સેક્સનો ભવ ઊપજાવે . . . પણ □ જ વસ□ ત્ ફથીવાથ મ્મમં □ જ કામકથ્ત્ ષણ ન ઊપજાવે □ વું ચ બ્ની શકે છે.
- \* મણસો અલગ અલગ પ□ ઝકાથ્ના હોય છે. કેટલાકના મ્મમં અઠવાડયિ □ કાદ વાથ જ સેક્સની ઊત્ કંઠા જાગે છે. જ્યારે કેટલાક લોકો ચેવીસે કલાક મ્મમં સેક્સની કલ□ પના□ થડયા કથ્તં હોય છે.
- \* અમ્ક પુષ્પોને □ ક સ□ ત્ થી સાથેવાથ્વાથ સેક્સ ભેગ□ ચાબદ તેમથી ઘ્સ □ છો થઈ જાય છે. જ્યારે બ્હુ □ છા પુષ્પોને વાથ્વાથ્ના સેક્સ બદ □ જ પાત્ થમં ઘ્સ જળવાઈ થ્દે છે.
- \* સ□ ત્ થી પુષ્પના શાથીચકિ અંધ, ફીગથ, વજન, રૂસ□ તે, સ□ નાયુબ્ધ□ ધ્સ, વળાંકો કયાની કમ્નીચત ચ્બીના થ્ વગેરે જીવનના દરેક ત્કકે ( જેવાકે પ□ થેગનન□ સી, ડીલીવથી, બમિથી□, ઊમ્, થીકવથી ) બ્દલત થ્દે છે. જે તેમા બહ□ ચ □ પીચથ્ન□ સમં ફેથ્કથે સથ્ જે છે. તેમી અસથ પાથ્ ટનથ્ની કામ્ચ□ છા ઊપથ પણ પડે છે.

{comments off}